

[20- Guj] Eng

Seat No: \_\_\_\_\_

No. of printed pages: 1

**SARDAR PATEL UNIVERSITY**  
**B.Com. (III Semester) (NC) Examination**  
**Tuesday, 5<sup>th</sup> January 2021**  
**10:00 am - 12:00 noon**  
**UB03ECOM02-Advanced Accounting and Auditing-VI**

**કુલ ગુણ: ૬૦**

નોંધ: નીચે દર્શાવેલા કુલ આઠ પ્રશ્નોમાથી કોઈપણ ચાર પ્રશ્નોના જવાબ લખો.

- પ્ર.૧ ઓડિટીંગનો અર્થ આપો અને ઓડિટીંગ અને હિસાબી પદ્ધતિનો તફાવત સ્પષ્ટ કરો. (૧૫)
- પ્ર.૨ ઓડિટીંગનું કાર્યક્ષેત્ર વિસ્તારથી સમજાવો. (૧૫)
- પ્ર.૩ સતત ઓડિટ અને વાર્ષિક ઓડિટ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. (૧૫)
- પ્ર.૪ ઓડિટ કાર્યપત્રકનાં ફાયદા અને મર્યાદા પર નોંધ લખો. (૧૫)
- પ્ર.૫ આંતરિક તપાસ અને આંતરિક ઓડિટ અંગે ઓડિટરની જવાબદારીઓ વર્ણવો. (૧૫)
- પ્ર.૬ તપાસ (Investigation) વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વર્ણવો. (૧૫)
- પ્ર.૭ સારા વાઉચર (Voucher) ના સમાવિષ્ટોની ચર્ચા કરો. (૧૫)
- પ્ર.૮ સ્થિર મિલકતની ખરીદી વખતે વાઉચરની પ્રક્રિયા વર્ણવો. (૧૫)

----- X -----

**SARDAR PATEL UNIVERSITY**  
**BCOM (THIRD SEMSTER) (UB03ECOM02) (NC)**  
**Advanced Accounting & Auditing- VI ( Principals of Auditing)**

**Date:- 5/1/2021**

**Time:- 10.00 to 12.00 p.m**

**Total marks:- 60**

**Note:- Attempt any 4 question out of 8 questions**

- Q.1)** Define Auditing and write a note on Difference between Auditing & Accountancy. (15)
- Q.2)** Discuss the scope of auditing in detail. (15)
- Q.3)** Differentiate between continuous Audit & Annual Audit (15)
- Q.4)** Write a note on Advantages & disadvantages and Audit working paper. (15)
- Q.5)** Explain the Auditors duties regarding Internal check & Internal Audit (15)
- Q.6)** Describe the Points to be considered while conducting the investigation (15)
- Q.7)** Explain the Contents of a good voucher (15)
- Q.8)** Explain the vouching procedure when Purchase of fixed Assets is done. (15)

— x —

②